

પરીક્ષા વિદ્યાર્થીની કે વાલીની !

આજથી ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. બોર્ડની પરીક્ષાની અસર વિદ્યાર્થીની કારકિર્દી પર ખૂબ જ મોટી અસર કરે છે. આ બાબતથી વિદ્યાર્થીને વાલી સારી રીતે પરિચિત હોવાથી તેને ખૂબ જ ગંભીરતાથી લે છે. આમ તો કોઈપણ વિદ્યાર્થીની પરીક્ષાને તેના વાલી દ્રેક વખતે ગંભીરતાથી જ લતા હોય છે. જે બાબત એક રીતે જોવા જઈએ તો સારી બાબત છે, કારણાકે તેનો અર્થ એવો ઘટાવી શકાય કે વાલીમાં જાગૃતિ આવી છે. પણ વાલી અને તેમાં પણ મમ્મીઓ દ્રેક પરીક્ષાને વધારે પડતી ગંભીરતાથી લે છે, ત્યારે એવું લાગે છે કે પરીક્ષા વાલીની છે કે વિદ્યાર્થીની ! ૧ થી ૪ ધોરણમાં અભ્યાસ કરતાં બાળકના પાઠ્યપુસ્તકની વિગત જેટલી બાળકને આવકે છે તેનાં કરતાં તેની મમ્મીને વધારે આવકતી હોય છે. બાળકને પરીક્ષાની સ્કીમની જેટલી ખબર હોય છે તેના કરતાં તેની મમ્મીને વધારે ખબર હોય છે. પરીક્ષા સમયે મમ્મીનું રૈક્ર સ્વરૂપ અને પપ્પાનું બિચારાપણું જોવા મળે છે. પણ બોર્ડની પરીક્ષામાં તો મમ્મી અને પપ્પા બંનેનું રૈક્ર સ્વરૂપ ને વિદ્યાર્થીનું બિચારાપણું જોવા મળે છે.

પરીક્ષા પૂર્વે શું ખાવું, ક્યારે ખાવું અને કેટલું ખાવું તે મમ્મી, પપ્પા અને તેમના મિત્રો નક્કી કરે છે. જેનો સતત ચોકી પહેરો પણ રહેતો હોય છે. ૧૫ કે ૧૭ વર્ષના વિદ્યાર્થીએ ક્યારે આરામ કરવો, કેટલો આરામ કરવો તે પણ આ મમ્મી-પપ્પા જ નક્કી કરતાં હોય છે. તે સમયે તેમના મોઢામાંથી નીકળતાં એક એક શબ્દની નકારાત્મક અસર વિદ્યાર્થી પર જે પડે છે તેની તેમને ક્યારેય કટ્પના કરી નથી. વળી પાછા એ જ મમ્મી-પપ્પા કહે છે પણ ખરાં કે, “ અમે તો તેની પાસે કોઈ અપેક્ષા રાખતાં નથી, તેને જેટલું વાંચવું હોય તેટલું તેની રીતે વાંચે છે. પરીક્ષાનું જે પરિણામ આવે તે અમને મંજૂર છે” વગેરે. પણ મમ્મી-પપ્પાના શબ્દો જુદા અને વર્તન જુદું હોય છે. સોસાયટીના અન્ય સભ્ય સાથે સારા દેખાવા માટેના જ શબ્દો અને વર્તન હોય છે.

પરીક્ષાના દિવસો જેમ જેમ નજીક આવતાં જાય તેમતેમ મમ્મી-પપ્પાનું ટેન્શન વધતું જાય છે. જે જોઈને પેલો વિદ્યાર્થી પણ બાપડો-બિચારો બનીને ટેન્શનમાં આવી જાય છે. ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ધો. ૧૦ નાપાસ તેની મમ્મી કે પડોશી સલાહ આપતા હોય છે!

આધુનિક જમાનાની આધુનિક શુભેચ્છાઓ તો વળી ખરી જ. પરીક્ષા શરૂ થવાના આગલા દિવસે વિદ્યાર્થીના સગાં-સ્નેહીજનો પેન કે ખુકે લઇને બેસતાં વર્ષની જેમ શુભેચ્છા વ્યક્ત કરવાં નીખળી પડે છે. ત્યારે મમ્મી-પપ્પા બોલે છે કે, “ આ મળવા આવનાર સગાંઓથી તો અમારો દીકરો ખૂબ જ ડિસ્ટર્બ થાય છે. તેનું ભણવાનું બગડે છે. આ લોકોએ સમજીને જ ન આવવું જોઈએ.” પણ જો કોઈ નજીકનાં સગાં મળવા ન આવે અને દૂરનાં સગાં મળવા આવે તો વળી આ મમ્મી-પપ્પા કહે છે કે, “ જોયું ફલાણાં ભાઈ મળવાં પણ ના આવ્યાં ! ”

પરીક્ષાના દિવસે પેપર કેવી રીતે લખવું, શું લખવું વગેરેની સલાહ આપતાં વાતી ક્યારેક તો ઉચ્ચેરાટમાં અવું પણ સંભળાવી છે કે, “ કોઈ ખાલીજગ્યા જેવું ન આવડે તો બાજુવાળાને પૂછી લેજે. એ ચોરી ના કહેવાચ.” જે શાળામાં વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા હોય તે શાળાના શિક્ષકોને આગલા દિવસે વાતી ઢ્રારા મળવા જવું અને ક્યારેક ખોટાં દબાણ લાવવા તે બાબતો જ વિદ્યાર્થીને વધારે દબાણમાં લાવી શકે છે.

પરીક્ષાની આગલી રાત્રે અગત્યના પ્રક્ષો માટે અન્ય વાતી કે શિક્ષકોનો સંપર્ક કરવો તે કોઈ પણ રીતે યોગ્ય ન હોવાં છતાં વાતી તે બાબત ચૂકૃતા નથી.

પેપર આપીને બહાર નીકળતાં વિદ્યાર્થીને પહેલો પ્રશ્ન એ હોય છે કે, કેવું પેપર ગયું? જો પેપર ખરાબ ગયું હોય અને વિદ્યાર્થી સાચો જવાબ આપે કે પખ્ખા થોડું ખરાબ ગયું છે. તો કેટલાંક વાતી ગુસ્સે થઈને બિચારા વિદ્યાર્થીને ખખડાવી નાંખે છે. અમે કહેતાં હિતાં કે ભાઈ વાંચ. પણ અમારું કોણ સાંભળે છે. હવે લોઢા ટીપવા જજે. વગેરે વગરે. આવા સમયે વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે. ભલે એક પેપર ખરાબ ગયું બાકીના સારા જશો. જે થયું તે થઈ ગયું. તેનો વિચાર કરવાના બદલે બાકીના પેપર વિશેની ચર્ચા કરવી વધારે યોગ્ય ગણાશે.

કોઈ પેપર ઘાર્યા કરતાં કઠિન નીકળે તો તેમાં વાતીઓની એક જ ચર્ચા કે આખું વર્ષ વાંચ્યાં નહીં, પછી પેપર અધ્યરું જ લાગે ને! અથવા તો શિક્ષક પર તૂટી પડશે કે આવું તો પેપર કઢાતું હશો. વર્ગમાં ભણાવતાં જ નથી. વગેરે.

પરીક્ષા અગાઉના કેટલાક દિવસ વાતી ઓફીસમાંથી રજા લઈને વિદ્યાર્થીની સામે સતત હાજર રહે છે. ઈવધાર્થી કરતાં તેનાં વાતી વધારે ઉજાગરાં કરે છે. આ બધી બાબતની અસર વિદ્યાર્થી પર પડ્યા વિના રહેતી નથી. જેથી અપરિપક્વ ગણાતો વિદ્યાર્થી ઝડપથી દબાણ અનુભવવા લાગે છે. ત્યારે જ તેના મનમાં થાય છે કે મમ્મી-પખ્ખાની ઈરછા મુજબનું પરિણામ આવશે કે કેમ? આ દબાણ દિવસે વધતું જાય છે. જે પરીક્ષાની આગલી રાત્રે વિશેષ જોવા મળે છે. આ વખતે વાતી પાછા વિદ્યાર્થીને સલાહ આપે છે કે, ગભરાવવાનું નહીં. હિંમત રાખ વગેરે. અરે ભાઈ! જો તમારામાં હિંમત હતી? જો તમે જ હિંમત હારી ગયા છો તો પછી તમારું બાળક પણ હિંમત હારી જવાનું જ છે. શાળાના દરવાજા સુધી મુકવા જનારા અને પરીક્ષા પૂરી થઈ ગયાં પછી બહાર નીકળતાં વિદ્યાર્થીને શરબતની બોટલ ધરનાર વાતીના આ વર્તનો જ વિદ્યાર્થીને દબાણાચુક્ત બનાવે છે.

દુંકમાં, આજનો વાતી પરીક્ષાર્થી બની ગયો છે. તેમનું બાળક ગમેતે ભોગે અશક્યને પણ શક્ય બનાવીને પરીક્ષામાં ઊંચું પરિણામ મેળવે તે જ તેમનો હેતુ હોય છે. જે વિદ્યાર્થીને ડિપ્રેશન કે ટેન્શનમાં લાવી મૂકે છે.